

Smt. Indira Kotak, President, Ladies' Wing, IMC

Friends, we have gathered here to pay homage to the great soul of Shri Dhirubhai. My deep sympathies are with Kokilaben and family, my *shradhanjali* is only a few couplets, which his memories have inspired me to write. I would tell as it is in Gujarati.

ચિરવિદાય લેવા છતાંય ચિરંજીવી થઈ ગયા.
'શતાયુ ભવ'ના આશીર્વાદ હતા કે ન હતા,
કિંતુ સહસ્ર યુગનું આયુષ્ય પામ્યા.
ભૂગોળના નકશાની સીમામાં બિન્દુ નામશેષ થયું, એ અવશેષ રહ્યા,
પરંતુ ઇતિહાસના પાને તો અમર થઈ ગયા.
પાર્થિવ બની કેવળ વિજયી બન્યા,
અપાર્થિવ થઈને અજેય થયા.

Let me give you this in english. You have achieved infinite fame not only for hundred years, but thousands of years to come. In geographical or physical world your existence may not be there, but in history you've become a legend. You have done your worldly task ...but for the world you've become invincible. Let me end with a Tulsi's doha.

जब तुम आयो जगत में, जग हँसे तुम रोय
करनी ऐसी कर चलो तुम हसो जग रोय।